



**P-001-014301**      Seat No. \_\_\_\_\_  
**M. A. (Sem. III) (CBCS) Examination**  
May / June - 2018  
**Sanskrit : Paper-07**  
*(Unseen and Essay)*  
*(Old Course)*

**Faculty Code : 001  
Subject Code : 014301**

Time :  $2\frac{1}{2}$  Hours] [Total Marks : 70]

- |        |  |          |
|--------|--|----------|
| ૧<br>૧ | <p>નીચેનામંથી કોઈપણ એક ગદ્યખંડના પ્રશ્નોનાં જવાબ સંસ્કૃતમાં આપો :<br/>         Give the answer of questions in Sanskrit any <b>one</b> of the following :</p> <p>(૧) તતો રથમારુહ્ય સુવેગસ્તક્ષશિલાં પ્રતિ પ્રતસ્થે । માર્ગ ચ ગચ્છતસ્તસ્ય વામ નેત્રં પસ્પન્દે । અન્યાન્યપિ ચાંશકુનાનિ જાતાનિ । તથાઽપિ સ ગ્રામનગરાદીન્ન લઙ્ગુધયન્ તરુખણ્ડસરોવરાદિષુ કુત્રાઽપિ વિશ્રામમકુર્વન્ શ્વાપદાદિભિર્ભર્યંકરાં સઘનાં મહાટવીં પ્રાય । સમુલ્લઙ્ગ્ય ભરતાજ્ઞાનભિજ્ઞાં બહલી દેશં પ્રાત્વાન્ । તત્ત્વ ચ તક્ષશિલાનગરીં સર્વતઃ સમૃદ્ધિમતીં પ્રાપ્ય સિંહદ્વારે દ્વારપાલેન પ્રતિષ્ઠિદ્ધસ્તસ્થૈ । તવ જ્યેષ્ઠભાતુર્દૂતો દ્વારિ તિષ્ઠતી તિ નિવેદિતેન રાજ્ઞાઽનુમતે: સ સુવેગો વેત્ત્રિણાઽન્તઃ પ્રાવિશત્ ।</p> | ૧૪<br>14 |
|--------|--|----------|

**प्रश्नाः —**

- (१) तक्षशिलां प्रति कः प्रतस्थे ?

(२) कस्य वामं नेत्रं पस्पन्दे ?

(३) सुवेगः कां समुल्लङ्घ्य बहलीदेशं प्राप्तवान् ?

(४) सिंह द्वारे केन प्रतिषिद्धं सः तस्थौ ?

(५) तक्षशिला नगरी कीदृशी आसीत् ?

(६) केन सुवेगः अन्तः प्राविशत् ?

(७) सुवेगः कत्र विश्राममकरोते ?

(२) नहुषनामा चन्द्रवंश्यो भूपो बभूव । आत्मनः सर्वाः प्रजाः स्वाः प्रजा इव पालयन् स शतमश्वेधानाजहार । स यज्ञफलरूपं देवराज्यं प्राप । अनेन मदान्धः स सप्तर्षीन् स्वां शिविकां वाहयामास । एकदा नहुषः शच्या महालयं गन्तुं प्रतस्थे । वामनेनागस्त्येन मुनिना प्रांशुभिरन्यैर्मुनिभिश्चोह्यमाना शिविका भृशं चकम्पे । इमं कम्पम् सहमानो नहुषो वामनमगस्त्यं ‘सर्प सर्प’ इत्युक्त्वा त्वरयामास । सञ्जातकोपो मुनिः ‘सर्पो भव’ इति तं शशाप ।

**प्रश्नाः —**

- (१) नहुषः कस्मिन् वंशे बभूव ?
- (२) नहुषः केन फलेन देवराज्यं प्राप ?
- (३) मदान्धः नहुषः किमकरोत् ?
- (४) शिविका कथं भृशं चकम्पे ?
- (५) अगस्त्यः नहुषं कस्मात् कारणात् शशाप ?
- (६) नहुषः प्रजायाः पालनं केन प्रकारेण अकरोत् ?
- (७) नहुषः कस्य महालयं गन्तुं प्रतस्थे ?

२ नीयेनाभांथी क्रोधपृष्ठा औंक गद्यभंडनो गुजरातीभां अनुवाद करो : १४

२ Translate in Gujarati any **one** of the following passages : 14

(१) विद्याध्ययनेन मानवोऽमरत्वमानोति । ज्ञानेन विना नरः पशुरेवास्ति । यस्य देशस्य प्रजा विद्यया हीनाऽस्ति, अज्ञानान्धकारे पतिता सा प्रजा कदाप्युन्नतिं नाप्नोति । विद्या एव जनस्य सौन्दर्यमस्ति । विद्या त्वीदृशं धनं वर्तते यदतीव प्रच्छनं गुप्तं चास्ति । यदा जनः परदेशं गच्छति तदा विद्यैव तस्य बन्धुजनो भवति । राजसु विद्यैव पूज्यते । विद्यैव गुरुणामपि गुरुः । अतः सम्यगेव कथितं यद्विद्याविहीनो जनः पशुरेवास्ति ।

(२) एकः जनः नवां धेनुं क्रेतुमापणं गतः । तत्र तेन धेन्वा सार्धं स्थितः कश्चित्पुरुषो दृष्ट उक्तश्च – ‘एषा मदीया गौः’ । असौ पुरुषः प्रत्यभाषत – ‘तव सखलनं भवति । आ चिरकालादेषा धेनुर्मम वर्तते’ । कृषको धेनोर्नेत्रे स्वकराभ्यामाच्छाद्य पप्रच्छ – ‘यदेवं तर्ह्यषां गौः केन नेत्रेण काणा’ इति । असौ प्रत्यभाषत – ‘अवश्यं वामेन नयनेन’ इति । परं धेनुरेकेनापि लोचनेन काणा नासीत् ।

३ नीयेनाभांथी क्रोधपृष्ठा बेनो गुजरातीभां अनुवाद करो : १४

३ Translate in Gujarati any **two** of the following : 14

(१) रे रे चातक सावधानमनसा मित्र क्षणं श्रूयतामभोदा बहवो वसन्ति गगने सर्वेऽपि नैतादृशाः । केचिद् वृष्टिभिरार्दयन्ति वसुधां गर्जन्ति केचिद् वृथा यं यं पश्यसि तस्य तस्य पुरतो मा ब्रूहि दीनं वचः ॥

- (२) पौलस्त्यः कथमन्यदारहरणे दोषं न विज्ञातवान् रामेणापि कथं न हेमहरिणस्यासभ्वो लक्षितः । अक्षैश्चापि युधिष्ठिरेण सहसा प्राप्तो ह्यनर्थः कथं प्रत्यासन्नविपत्तिमूढमनसां प्रायो मतिः क्षीयते ॥
- (३) अपारे संसारे कविरेकः प्रजापतिः ।  
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते ॥  
शृङ्गारी चेल्कविः काव्ये जातं रसमयं जगत् ।  
स एव वीतरागश्चेन्नीरसं सर्वमेव तत् ॥
- (४) रात्रिगमिष्यति भविष्यति सुप्रभातं  
भास्वानुरुदेष्यति हसिष्यति पङ्कजश्रीः ।  
इत्यं विचिन्तयति कोशगते द्विरेके  
हा हन्त हन्त नलिनीं गज उज्जहार ॥

४ नीचेनाभांथी કોઈપણ એક ગદખંડનો સંસ્કૃતમાં અનુવાદ કરો : १४

4 Translate any one of the following passage in Sanskrit : 14

- (१) અંધ રાજા ધૃતરાષ્ટ્ર લાક્ષ્મિક વ્યક્તિ છે. તે નથી સર્વથા સત્તુ કે સર્વથા અસત્તુ, છતાં તે સત્તુ અને અસત્તુથી પર તો નથી જ. માનવતાને કાળનાં આરંભથી જ જે દ્વાંદ્વે ચકડેળે ચડાવી છે તે દ્વાંદ્વની પકડમાં તે સપડાયો છે. તેનો પ્રધાનદોષ એ છે કે તે નિર્બળ અને અસ્થિર છે, લોલકની પેઠે સત્તુ અને અસત્તુની વચ્ચે તે જુલ્યા કરે છે, તેનામાં સદ્ગુર્તિઓ છે પણ તે ભાત્ર વૃત્તિઓ જ છે અને તે પણ બહુ નબળી. ધૃતરાષ્ટ્ર હંમેશા સ્વીકારતો રહે છે, છેવટે તેને લાગ્યા કરે છે, કે પાંડવોને અન્યાય થઈ રહ્યો છે. છતાં તે પોતાના પુત્રોને નિર્દોષ ગણવાની અને તેમની દુષ્ટતા અને અવિનયી કર્મોને પોતાની જાતને તેમજ બીજાઓને સમજાવી દેવાની વૃત્તિ સેવતો રહે છે.
- (1) The blind King Dhrtarastra is a typical personality. He is neither wholly good nor wholly evil, but he is definitely not beyond good and evil, rather he is very much in the grip of that pair which has kept humanity on the whirl from the beginning of time. His besetting sin is just that he is weak and vacillating oscillating continuously, like a Pendulum between good and evil. He has good impulses, but they are no more than impulses and very weak ones at that Dhrtarastra throughout recognizes, or at least feels, that injustice is being done to the Pandavas, but he is ever prone to exonerate his own sons and explain away to himself and others their mischievous activities and wickednesses.

- (2) વિદ્યાપીઠ એ તાત્ત્વિક રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંયુક્ત સંસ્થા છે. એ બંને વચ્ચેના સંબંધો પવિત્ર પ્રકારનાં રહ્યા છે. આપણે આપણા યુવાન વર્ગને જે પ્રકારનું શિક્ષણ આપીએ છીએ, તેની કસોટી જે જાતનાં પુરુષો અને સ્ત્રીઓ આપણે શિક્ષક તરીકે મેળવીએ છીએ તેના પરથી ચોક્કસ રીતે થાય છે. ભવ્ય મકાનો અને સાધન સામગ્રી મહાન શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં. દેશમાં રહેલી ઉત્તમક્ષમતાને સારા પ્રમાણામાં શિક્ષણનાં વ્યવસાયમાં આકર્ષવા માટે દરેકે પ્રયત્ન કરવો જે જોઈએ.

(2) A university is essentially a corporation of teachers and students. The relations between the two have been of a scared character. The kind of education that we provide for our youth is determined overwhelmingly by the kind of men and women we secure as teachers magnificent building and equipments are no substitute for the great teacher. Every attempts hould be made to draw a good proportion of the best ability in the country in to the teaching profession.

૫ નીચેનામાંથી કોઈપણ એક વિશે સંસ્કરતમાં નિબંધ લખો.

**5** Write an essay in Sanskrit on any **one** of the following 14  
Passages :

- (१) कविकुलगुरुः कालिदासः ।
  - (२) विद्याधनं सर्वधनप्रधानम् ।
  - (३) भारतीयासंस्कृतिः ।
  - (४) आतंकवादग्रस्तं विश्वम् ।
  - (५) उद्यमेन हि सिध्यन्तिकार्याणि ।